

SYBCOM SEM 2
ADVANCED ACCOUNT & AUDITING -2
મૂડી ઘટાડાના હિસાબો

પ્રશ્ન: ૧ મૂડીઘટાડા અંગે આમનોંધ લખો.

૧. ડિરેક્ટરને મળેલી ફી રૂ. ૧૫,૦૦૦ કંપનીને પરત કરી.
૨. ડિબેન્યર હોલ્ડરો ૧૮%ના રૂ. ૧૦,૦૦,૦૦૦નાં ડિબેન્યરો ધરાવે છે. તે ડિબેન્યરની અંશતઃ ચુકવણી માટે પ્લાન્ટ અને યંત્ર જેની ચોપડે કિંમત રૂ. ૪,૮૦,૦૦૦ છે તે રૂ. ૬,૦૦,૦૦૦ની કિંમતે લેવા સંમત થયા.
૩. મૂડી ઘટાડાની યોજના વખતે કંપનીને રૂ. ૩૦,૦૦૦ની સંભવિત જવાબદારી ચૂકવવાની થઈ. આ રકમ કંપનીએ ડિરેક્ટરે કંપનીને ધીરેલી રૂ. ૫૦,૦૦૦ની લોનમાંથી વસૂલ કરી અને બાકીની લોનની રકમ તેમજ સંભવિત જવાબદારી ચુકવી આપી.
૪. પ્રેફરન્સ શેર પર રૂ. ૫૦,૦૦૦નું ડીવીડન્ડ ચૂકવવાનું બાકી છે. પ્રેફરન્સ શેરહોલ્ડરો ૬૦% રકમ જતી કરવા સંમત થયા અને બાકીની રકમ માટે રૂ. ૧૦નો એક એવા ઇક્વિટી શેર સ્વીકાર્યા.
૫. કંપનીના લેણદારો રૂ. ૧,૫૦,૦૦૦ ના હતા. તે દરેકને રૂ. ૫૦ના તેમના લેણાં પેટે રૂ. ૧૦ની મૂળ કિંમતનો શેર, શેરદીઠ રૂ. ૨૫ના ભાવે આપવાનું તથા બાકીની રકમ એક વર્ષ બાદ ચૂકવવાનું નક્કી કર્યું.
૬. એક કંપની, ૩,૦૦,૦૦૦ ઇક્વિટી શેર દરેક રૂ. ૧૦નો એક એવા શેરનું રૂ. ૧ ની કિંમતમાં રૂપાંતર કરે છે. શેરહોલ્ડરોને ૮૦% શેર કંપનીને સોંપી દેવા જણાવ્યું.
૭. કંપનીને રૂ. ૭૫,૦૦૦નું સંભવિત દેવું ચૂકવવાનું છે. આ દેવાની ૫૦% રકમ કંપનીના ડિરેક્ટરે ચૂકવવાની છે, જેને માટે ડિરેક્ટરે ખાતરી આપી છે. ડિરેક્ટરે કંપનીને રૂ. ૬૨,૫૦૦ની લોન ધીરી છે. કંપનીએ જરૂરી રકમ ડિરેક્ટરની લોનમાંથી કાપી લઈને બાકીની રકમ ઇક્વિટી શેરમાં ચૂકવી. કંપનીએ સંભવિત દેવું ચૂકવી દીધું છે.
૮. ડિરેક્ટરોએ તેમની લેણી રકમના ૬૫% રકમ ઇક્વિટી શેરોમાં અને ૨૦% રોકડમાં સ્વીકારી જ અને બાકીની રૂ. ૨૬, ૨૫૦ની રકમ તેઓએ જતી કરી છે.
૯. ૮% ના રૂ. ૬,૦૦,૦૦૦ ના પ્રેફરન્સ શેરોનું ડિવિડન્ડ છેલ્લા બે વર્ષથી ચૂકવવાનું બાકી છે . મૂડી ઘટાડાની યોજનામાં રૂ. ૧૦૦ ના બાકી ડિવિડન્ડ પેટે રૂ. ૨૫ નો એક એવા ઇક્વિટી શેર ચુકતેના હિસાબે આપ્યા.
૧. મોના લિમિટેડનું તા. ૩૧-૧૨-૨૦૨૫ ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે :

વિગત	રૂ .
I. ઇક્વિટી અને જવાબદારીઓ :	
(૧) શેરહોલ્ડરોનાં ભંડોળો:	
(અ) શેરમૂડી : રૂ. ૧૦નો એક એવા ઇક્વિટી શેર(10,00,000/10=1,00,000)	૧૦,૦૦,૦૦૦
૧૦%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ દરેક રૂ. ૧૦નો પૂરો ભરપાઈ (6,00,000/10=60,000)	૬,૦૦,૦૦૦
(બ) અનામત અને વધારો: નફા-નુકસાન ખાતું	(૮,૧૦,૦૦૦)
(૨) બિનચાલુ દેવાં :	
(અ) લાંબા ગાળાનાં ઉછીનાં નાણાં : ૧૦%નાં સિક્યોર્ડ ડિબેન્યર	૪,૦૦,૦૦૦
ડિરેક્ટરની લોન	૧,૦૦,૦૦૦
(૩) ચાલુ દેવાં :	

(અ) ટૂંકા ગાળાનાં ઉછીનાં નાણાં : બેન્ક ઓવરડ્રાફ્ટ	૧,૪૦,૦૦૦
(બ) વેપારી દેવાં : લેણદારો	૨,૦૦,૦૦૦
(ક) અન્ય ચાલુ દેવાં : ડિબેન્ચર પર ચઢેલ વ્યાજ	૨૦,૦૦૦
કુલ સરવાળો	૧૬,૫૦,૦૦૦
II. મિલકતો:	
(૧) બિનચાલુ મિલકતો:(અ) કાયમી મિલકતો:	
(૧) દૃશ્ય મિલકતો : ફિલ્ડેડ જમીન	૪,૨૫,૦૦૦
પ્લાન્ટ	૨,૦૦,૦૦૦
(૨)અદૃશ્ય મિલકતો: પાઘડી	૮૦,૦૦૦
પેટન્ટ્સ	૭૦,૦૦૦
(બ) બિનચાલુ રોકાણો	૧,૩૦,૦૦૦
(ક) અન્ય બિનચાલુ મિલકતો: પ્રાથમિક ખર્ચો	૭૦,૦૦૦
(૨) ચાલુ મિલકતો : (અ) માલસામગ્રી: સ્ટોક	૨,૮૦,૦૦૦
(બ) વેપારી લેણાં: દેવાદારો	૩,૮૫,૦૦૦
કુલ સરવાળો	૧૬,૫૦,૦૦૦

તા. ૧-૧-૨૦૨૬ ના રોજ ટ્રિબ્યુનલે પુનઃચયનાની યોજના મંજૂર કરી :

- (૧) દરેક પ્રેક્ષરન્સ શેર રૂ. ૬ સુધી અને દરેક ઇક્વિટી શેર રૂ. ૮થી ઘટાડો.
 - (૨) રોકાણો રૂ. ૧,૬૦,૦૦૦માં વેચી દેવાં અને બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવી દેવો.
 - (૩) કંપની સામેનો દાવો રૂ. ૫૦,૦૦૦નો ચૂકવી દેવો જે પૈકી રૂ.૪૦,૦૦૦ ડિરેક્ટરની લોનમાંથી વસૂલ લઈ બાકીની લોન રૂ. ૫૦,૦૦૦ના પૂરા ભરપાઈ ઇક્વિટી શેર ચૂકવેના હિસાબે આપી, ચૂકવી દેવી.
 - (૪) લેણદારોને તેમનાં લેણાં પેટે ૮૦ % રકમ (રૂ.૧૦નો પૂરા ભરપાઈ) ઇક્વિટી શેરમાં હિસાબ ચૂકવે આપવી.
 - (૫) ડિબેન્ચર હોલ્ડર્સને તેમનાં પૂરાં લેણાં પેટે નવી કંપનીના ૧૨%ના ડિબેન્ચર આપવા.
 - (૬) પ્રેક્ષરન્સ શેર પર છેલ્લાં બે વર્ષના ચઢેલા ડિવિડન્ડ પેટે ૧ /૩ રકમ ચૂકવેના હિસાબે પૂરા ભરપાઈ ઇક્વિટી શેર આપી ચૂકવી દેવી.
 - (૭) અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી.
- મૂડી ઘટાડા અંગે જરૂરી આમનોંધ લખી મૂડી ઘટાડા પછીનું પાકું સરવૈયું તૈયાર કરો.

૨. મહેક લિ. નું તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે :

વિગત	રૂ.
1. ઇક્વિટી અને જવાબદારીઓ :	
(૧) શેરહોલ્ડરોનાં ભંડોળો:	
(અ) શેરમૂડી :દરેક રૂ. ૧૦૦નો એક એવા ઇક્વિટી શેર(3,20,000/100=3200)	૩,૨૦,૦૦૦
૮%ના પ્રેક્ષરન્સ શેર દરેક રૂ. ૧૦૦નો એવા(1,60,000/100=1600)=	૧,૬૦,૦૦૦
(બ) અનામત અને વધારો: નફા-નુકસાન ખાતું	(૪૮,૦૦૦)
(૨) બિનચાલુ દેવાં :	
(અ) લાંબા ગાળાનાં ઉછીનાં નાણાં : ૧૦%નાં ડિબેન્ચર્સ	૧,૬૦,૦૦૦
ડિરેક્ટરની લોન	૬૪,૦૦૦
(૩) ચાલુ દેવાં :	
(અ) ટૂંકા ગાળાનાં ઉછીનાં નાણાં : બેન્ક ઓવરડ્રાફ્ટ	૩૮,૪૦૦
(બ) વેપારી દેવાં : લેણદારો	૮૦,૦૦૦
(ક) અન્ય ચાલુ દેવાં : ડિબેન્ચર્સનું બાકી વ્યાજ	૧૬,૦૦૦

	કુલ સરવાળો	૭,૮૦,૪૦૦
II. મિલકતો:		
(૧) બિનચાલુ મિલકતો: (અ) કાયમી મિલકતો :		
(૧) દૃશ્ય મિલકતો : ફ્લોર મિલકતો		૧,૬૦,૦૦૦
પ્લાન્ટ-મશીનરી		૨,૧૬,૦૦૦
(૨) અદૃશ્ય મિલકતો: પાઘડી		૮૦,૦૦૦
(બ) બિનચાલુ રોકાણો		૮૦,૦૦૦
(ક) અન્ય બિનચાલુ મિલકતો : પ્રાથમિક ખર્ચો		૩૨,૦૦૦
(૨) ચાલુ મિલકતો :		
(અ) માલસામગ્રી : સ્ટોક		૧,૪૪,૦૦૦
(બ) વેપારી લેણાં : દેવાદારો		૭૮,૪૦૦
	કુલ સરવાળો	૭,૮૦,૪૦૦

મૂડી ઘટાડાની યોજના નીચે પ્રમાણે ટ્રિબ્યુનલ તરફથી મંજૂર કરવામાં આવી :

(૧) ઇક્વિટી શેર, શેરદીઠ રૂ. ૮૦ થી ઘટાડવો.

(૨) પ્રેફરન્સ શેર, શેરદીઠ રૂ. ૬૦ સુધી ઘટાડવો.

(૩) ડિબેન્યર્સલોડરોએ તેઓનું ચઢેલું વ્યાજ રોકડમાં લેવાનું અને પોતાની લેણી થતી રકમની અંશતઃ ચુકવણી પેટે રૂ. ૮૦,૦૦૦ ની ચોપડે કિંમતની ફ્લોર મિલકત રૂ. ૧,૧૨,૦૦૦ ની કિંમતે લઈ લેવાનું સ્વીકાર્યું.

(૪) ડિરેક્ટરોએ તેઓની લોનની પતાવટ રૂપે ૮૦% રકમ ઇક્વિટી શેરમાં, ૧૦% રકમ રોકડમાં અને બાકીની રકમ જતી કરવાનું સ્વીકાર્યું.

(૫) બાકીની રકમનો ઉપયોગ પ્લાન્ટ અને સ્ટોકને તેમની ચોપડે કિંમતના પ્રમાણમાં માંડી વાળવા કરવાનો છે.

તમારે આમનોંધ લખવાની છે અને મૂડી ઘટાડા પછીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે.

૩. દિવ્યા લિ.નાણાકીય મુશ્કેલી અનુભવે છે.તા.૩૧-૩-૨૦૨૬ ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે :

વિગત	રૂ.
(૧) ઇક્વિટી અને જવાબદારીઓ :	
(૧) શેરહોલ્ડરોનાં ભંડોળો:	
(અ) શેરમૂડી : ઇક્વિટી શેર દરેક રૂ. ૧૦ નો (20,00,000/10=2,00,000)	૨૦,૦૦,૦૦૦
૧૦%ના પ્રેફરન્સ શેર દરેક રૂ. ૧૦૦ નો (8,00,000/100=8000)	૮,૦૦,૦૦૦
(બ) અનામત અને વધારો: નફા-નુકસાન ખાતું	(૫,૮૦,૦૦૦)
(૨) બિનચાલુ દેવાં :	
(અ) લાંબા ગાળાનાં ઉછીનાં નાણાં : ૧૨%ના ડિબેન્યર	૬,૦૦,૦૦૦
ડિરેક્ટરની લોન	૨,૦૦,૦૦૦
(૩) ચાલુ દેવાં :	
(અ) ટૂંકા ગાળાનાં ઉછીનાં નાણાં : બેન્ક ઓવર ડ્રાફ્ટ	૩,૦૦,૦૦૦
(બ) વેપારી દેવાં : લેણદારો	૫,૧૮,૦૦૦
(ક) અન્ય ચાલુ દેવાં : ડિબેન્યર્સનું બાકી વ્યાજ	૭૨,૦૦૦
	કુલ સરવાળો ૩૮,૧૦,૦૦૦
II. મિલકતો:	
(૧) બિનચાલુ મિલકતો:(અ) કાયમી મિલકતો : (૧) દૃશ્ય મિલકતો : જમીન	૮,૦૦,૦૦૦
મકાન	૬,૦૦,૦૦૦
મશીનરી	૨,૮૦,૦૦૦
(૨) અદૃશ્ય મિલકતો : પાઘડી	૬,૦૦,૦૦૦

(બ) બિનચાલુ રોકાણો	૪,૫૦,૦૦૦
(ક) અન્ય બિનચાલુ મિલકતો : જાહેરાત ઉપલક્ષ ખાતું	૫૦,૦૦૦
નફાનુકસાન ખાતું (ઉધાર)	૫,૮૦,૦૦૦
(૨) ચાલુ મિલકતો : (અ) માલસામગ્રી: સ્ટોક	૭,૨૦,૦૦૦
(બ) વેપારી લેણાં : દેવાદારો	૪,૦૦,૦૦૦
(ક) રોકડ અને રોકડ સમકક્ષ : રોકડ સિલક	૧૦,૦૦૦
કુલ સરવાળો	૩૮,૧૦,૦૦૦

પુનઃચયનાની નીચે મુજબની યોજના સ્વીકારવામાં અને અમલમાં મૂકવામાં આવી:

- (૧) ઇક્વિટી શેર, શેરદીઠ રૂ. ૨.૫૦ સુધી ઘટાડવા.
- (૨) પ્રેફરન્સ શેરહોલ્ડરોને ૧૫%ના ૬,૦૦૦ પ્રેફરન્સ શેર દરેક રૂ. ૧૦૦ના અને ૮૦,૦૦૦ ઇક્વિટી શેર દરેક રૂ. ૨.૫૦ના આપવા.
- (૩) ડિબેન્યરહોલ્ડરોને તેમને ચૂકવવાપાત્ર વ્યાજના બદલામાં ૨૦,૦૦૦ ઇક્વિટી શેર દરેક રૂ. ૨.૫૦ના આપવા. ડિબેન્યર પર વ્યાજનો દર વધારીને ૧૫% કરવો. વર્તમાનમાં ડિબેન્યરહોલ્ડરોને રૂ. ૧૦૦ નો એક એવા ૧૫%ના રૂ. ૨,૦૦,૦૦૦ના બીજા ડિબેન્યર રૂ. ૮૦ના ભાવે આપવા.
- (૪) રૂ. ૮૦,૦૦૦ની ડિસ્કન્ટની લોન રદ કરવી અને બાકીની લોન દરેક રૂ. ૨.૫૦ના ૨૦,૦૦૦ ઇક્વિટી શેર આપી ચૂકતે કરવી.
- (૫) રોકાણો રૂ. ૬,૦૦,૦૦૦માં વેચી દીધાં. બેન્ક ઓવરડ્રાફ્ટ ચૂકવી દેવામાં આવ્યો.
- (૬) રૂ. ૩,૧૮,૦૦૦ના લેણદારોને તાત્કાલિક ચૂકવી દેવા અને બાકીની રકમ ત્રિમાસિક ગાળા ચૂકવવી.
- (૭) તમામ અદૃશ્ય મિલકતો માંડી વાળવી.
- (૮) મિલકતોનું વાજબી મૂલ્ય નીચે મુજબ આંકવામાં આવ્યું:

દેવાદારો	૩,૬૦,૦૦૦
સ્ટોક	૬,૪૦,૦૦૦
મશીનરી	૨,૦૦,૦૦૦
મકાન	૫,૦૦,૦૦૦
જમીન	૬,૪૦,૦૦૦

કંપનીના ચોપડે આમનોંધ લખો અને યોજના પછીનું તેનું પાકું સરવૈયું તૈયાર કરો.

૪. સર્વોત્તમ લિમિટેડનું તા. ૩૧-૩-૨૦૨૬ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું :

વિગત	રૂ.
I. ઇક્વિટી અને જવાબદારીઓ:	
(૧) શેરહોલ્ડરોનાં ભંડોળો:	
(અ) શેરમૂડી : ૨,૦૦૦ ઇક્વિટી શેર દરેક રૂ. ૧૦૦નો પૂરો ભરાયેલ	૨,૦૦,૦૦૦
૧,૦૦૦ ૧૦%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર દરેક રૂ. ૧૦૦નો	૧,૦૦,૦૦૦
(બ) અનામત અને વધારો : સામાન્ય અનામત	૨૦,૦૦૦
(૨) બિનચાલુ દેવાં : (અ) લાંબા ગાળાનાં ઉછીનાં નાણાં : ૧૫% ના ડિબેન્યર	૧,૦૦,૦૦૦
૧૦%ની બેન્ક લોન	૫૦,૦૦૦
(૩) ચાલુ દેવાં :	
(અ) વેપારી દેવાં : લેણદારો	૬૫,૦૦૦
(બ) અન્ય ચાલુ દેવાં : ડિબેન્યરનું બાકી વ્યાજ	૧૫,૦૦૦
કુલ સરવાળો	૫,૫૦,૦૦૦
મિલકતો:	

(૧) બિનચાલુ મિલકતો : (અ) કાયમી મિલકતો :	
(૧) દૃશ્ય મિલકતો : જમીન-મકાન (બજાર કિંમત રૂ. ૨,૦૦,૦૦૦)	૮૦,૦૦૦
મશીનરી (બજાર કિંમત રૂ. ૫૦,૦૦૦)	૭૦,૦૦૦
(૨) અદૃશ્ય મિલકતો : પાઘડી	૪૦,૦૦૦
પેટન્ટ્સ	૧૦,૦૦૦
(બ) અન્ય બિનચાલુ મિલકતો : નફાનુકસાન ખાતું (ઉધાર)	૨,૩૦,૦૦૦
(૨) ચાલુ મિલકતો : (અ) માલસામગ્રી : સ્ટોક	૩૦,૦૦૦
(બ) વેપારી લેણાં : દેવાદારો. ૮૦,૦૦૦	
બાદ : ધાવખાધ અનામત. ૪,૦૦૦	૭૬,૦૦૦
(ક) રોકડ અને રોકડ સમકક્ષ: રોકડ સિલક	૧૪,૦૦૦
કુલ સરવાળો	૫,૫૦,૦૦૦

કંપનીએ મૂડી ઘટાડાની નીચેની યોજના સ્વીકારી, જે તમામ પક્ષકારોએ માન્ય રાખી:

(૧) ઇક્વિટી શેરની કિંમત રૂ. ૮૦ થી ઘટાડવી.

(૨) પ્રેફરન્સ શેરને નોન-ક્યુમ્યુલેટિવમાં ફેરવવા અને તેની કિંમત રૂ. ૨૦ સુધી ઘટાડવી.

(૩) ડિબેન્યરહોલ્ડરો તેમનું બાકી વ્યાજ જતું કરશે.

(૪) ૧૦%ની બેન્ક લોન પર ૧૨ માસનું વ્યાજ ચૂકવવાનું બાકી હતું, જે રોકડથી ચૂકવી દેવું અને બેન્ક લોનના બદલે રૂ. ૧૦ની કિંમતના ઇક્વિટી શેર આપવા.

(૫) લેણદારો પોતાના લેણાંમાંથી ૪૦% જતા કરશે.

(૬) પ્રેફરન્સ શેરો પર બે વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હતું, જે પેટે દરેક રૂ. ૧૦૦ના બદલે રૂ. ૧૦નો એક ઇક્વિટી શેર આપવો.

(૭) તમામ અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી તથા અન્ય મિલકતો બજાર કિંમતે દર્શાવવી. દેવાદારોમાંથી રૂ. ૫,૦૦૦નો એક દેવાદાર નાદાર છે અને તેની પાસેથી કંઈ મળી શકે તેમ નથી. દેવાદારો પર ૧૦% ધાવખાધ અનામત રાખો.

કંપનીના ચોપડે આમનોંધ લખો અને પાકું સરવૈયું તૈયાર કરો.

પ. તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું નિવાના કંપની લિ.નું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે.

વિગત	રૂ.
I. ઇક્વિટી અને જવાબદારીઓ:	
(૧) શેરહોલ્ડરોનાં ભંડોળો:	
(અ) શેરમૂડી : ઇક્વિટી શેર દરેક રૂ. ૧૦નો પૂર્ણ ભરપાઈ	૨૦,૦૦,૦૦૦
૧૦%ની પ્રેફરન્સ શેર દરેક રૂ. ૧૦૦નો પૂર્ણ ભરપાઈ	૮,૦૦,૦૦૦
(બ) અનામત અને વધારો : સામાન્ય અનામત	(૫,૮૦,૦૦૦)
(૨) બિનચાલુ દેવાં :	૬,૦૦,૦૦૦
(અ) લાંબા ગાળાનાં ઉછીનાં નાણાં : ૧૨% નાં ડિબેન્યર્સ	
(બ) અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ: ડિરેક્ટરની લોન	૨,૦૦,૦૦૦
(૩) ચાલુ દેવાં :	
(અ) ટૂંકા ગાળાનાં ઉછીનાં નાણાં : બેંક ઓવર ડ્રાફ્ટ	૩,૦૦,૦૦૦
(બ) વેપારી દેવાં : લેણદારો	૫,૧૮,૦૦૦
(ક) અન્ય ચાલુ દેવાં : ડિબેન્યર પર બાકી વ્યાજ	૭૨,૦૦૦
કુલ સરવાળો	૩૮,૧૦,૦૦૦
II. મિલકતો:	
(૧) બિનચાલુ મિલકતો : (અ) કાયમી મિલકતો	૮,૦૦,૦૦૦

(૧) દૃશ્ય મિલકતો : જમીન	
મકાન	૬,૦૦,૦૦૦
યંત્રો	૨,૮૦,૦૦૦
(૨)અદૃશ્ય મિલકતો : પાઘડી	૬,૦૦,૦૦૦
(બ) બિનચાલુ રોકાણો	૪,૫૦,૦૦૦
(ક) અન્ય બિનચાલુ મિલકતો : જાહેરાત અંબેશ ખર્ચ	૫૦,૦૦૦
(૨) ચાલુ મિલકતો : (અ) માલસામગ્રી : સ્ટોક	૭,૨૦,૦૦૦
(બ) વેપારી લેણાં :દેવાદારો	૪,૦૦,૦૦૦
(ક) રોકડ અને રોકડ સમકક્ષ: બેંક સિલક	૧૦,૦૦૦
કુલ સરવાળો	૩૮,૧૦,૦૦૦

નીચે મુજબની પુનઃચયનાની યોજના સ્વીકારીને અપનાવવામાં આવી :

(૧)) ઇક્વિટી શેરની કિંમત રૂ. ૨.૫૦ સુધી ઘટાડવી.

(૨) પ્રેફરન્સ શેરહોલ્ડરોને ૧૫%ના ૬,૦૦૦ પ્રેફરન્સ શેર દરેક રૂ.૧૦૦નો અને ૮૦,૦૦૦ ઇક્વિટી શેર દરેક રૂ.૨.૫૦નો આપ્યા.

(૩) ડિબેન્યરહોલ્ડરોને ૨૦,૦૦૦ ઇક્વિટી શેર દરેક રૂ.૨.૫૦નો તેમના બાકી વ્યાજ પેટે આપવા.

ડિબેન્યરનો વ્યાજ દર ૧૫% કરવો.સ્વીકારે છે. રૂ.૨,૦૦,૦૦૦ના ૧૫%ના ડિબેન્યર્સ દરેક રૂ.૧૦૦નો રૂ.૮૦ લેખે આપવા.

(૪) ડીરેક્ટરની લોનના રૂ.૮૦,૦૦૦ માંડી વાળવા અને બાકી રકમ પેટે રૂ.૨.૫૦નો એક એવા ઇક્વિટી શેર ચૂકતે રકમ પેટે આપવા.

(૫) રોકાણો રૂ.૬,૦૦,૦૦૦ની કિંમતે વેચ્યા. બેંક ઓવરડ્રાફ્ટની રકમ ચુકવી દીધી.

(૬) રૂ.૩,૧૮,૦૦૦ના લેણદારો તાત્કાલિક ચુકવી દીધા અને બાકીની રકમ ત્રિમાસિક હપ્તામાં ચૂકવશે.

(૭) અદૃશ્ય મિલકતો માંડી વાળવાની છે.

(૮) મિલકતો નીચેની નવી કિંમતે ગણતરીમાં લેવી:

મિલકતો	રકમ
દેવાદારો	૩,૬૦,૦૦૦
સ્ટોક	૬,૪૦,૦૦૦
યંત્રો	૨,૦૦,૦૦૦
મકાન	૫,૦૦,૦૦૦
જમીન	૬,૪૦,૦૦૦

(૯) મૂડી ઘટાડા ખાતાની બાકી ની રકમ ઇક્વિટી શેર મૂડી માંડી વાળવા ઉપયોગમાં લેવી.

કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો અને ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરો.